



# સુરત મહાનગરપાલિકા

## શહેર વિકાસ (મધ્યસ્થ) ખાતું

આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫

પ્રો એક્ટિવ ડીસ્કલોજર (પી.એ.ડી.)

૨૦૨૨-૨૦૨૩

(તા.૦૧/૦૫/૨૦૨૩ ની સ્થિતિએ)

ઓફિસ:-

રૂમ નં.૮૦ બી ઈ, ૯૯,  
બીજો માળ,  
સુરત મહાનગરપાલિકા,  
મુગલીસરા, સુરત-૩૯૫૦૦૩

જાહેર માહિતી અધિકારી

અને

આસી. ઈજનેર  
શહેર વિકાસ (મધ્યસ્થ) ખાતું

## મુદ્રા નં.૦૧: સંસ્થાના કાર્યો અને ફરજોની વિગત:-

### (એ) મધ્યસ્થ (કેન્દ્રીય) કાર્યો :-

- (૧) હાઈરાઇઝ કોમર્શીયલ તથા લે—આઉટ પ્રકારના બાંધકામોની વિકાસ પરવાનગી.
- (૨) હાઈરાઇઝ અને કોમર્શીયલ પ્રકારના બાંધકામોની પ્રગતિનું નિયંત્રણ અને દેખરેખ.
- (૩) વિકાસ નિયંત્રણ નિયમોની જોગવાઈ મુજબ આર્કિટકેટ, ઓન્જીનીયર, સ્ટ્રક્ચરલ ડીઝાઇનર, સ્ટ્રક્ચરલ એક્ષપર્ટ, ડેવલપર, કલાક ઓફ વર્ક્સ, સાઈટ સુપરવાઈઝર, સાઈટ સુપરવાઈઝર ફોર ટોલ બિલ્ડીંગનાં રજીસ્ટ્રેશન અને શીન્યુઅલની કામગીરી.
- (૪) ખાતાની કામગીરીને લગતા નીતિ વિષયક નિર્ણયોની કામગીરી.

### (બી) વિકેન્દ્રીત કાર્યો :-

- (૧) બિન વાણીજ્ય હેતુના લો.રાઇઝ બિલ્ડીંગોનાં બાંધકામની વિકાસ પરવાનગી.
- (૨) હાઈરાઇઝ અને કોમર્શીયલ પ્રકારનાં બિલ્ડીંગો સિવાયનાં બિલ્ડીંગોના બાંધકામની પ્રગતિનું નિયંત્રણ અને દેખરેખ.
- (૩) મંજૂર થયેલ હાઈરાઇઝ અને કોમર્શીયલ પ્રકારનાં બિલ્ડીંગો સિવાયનાં તમામ બિનઅધિકૃત બાંધકામો માટે ગૃડા—૨૦૨૨ નાં અમલીકરણની કામગીરી.
- (૪) હાઈરાઇઝ અને કોમર્શીયલ પ્રકારના બાંધકામોની વસવાટની પરવાનગી આપ્યા બાદ નિયંત્રણની તથા મંજૂર પ્લાન વિરુદ્ધના તમામ બાંધકામોની નિયંત્રણ તથા દેખરેખની કામગીરી.

**મુદ્રા નં.૦૨: સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-**

અ.નં	કેડર	અધિકારી/કર્મચારીની સંખ્યા	કામગીરી
૧	શહેર વિકાસ અધિકારી	૦૧	<p>(૧) પોતાના તાબા હેઠળની કામગીરીની દેખરેખ રાખશે.</p> <p>(૨) નાયબ શહેર વિકાસ અધિકારી ધ્વારા સાદર કરેલ અહેવાલમાં જરૂરી નિર્ણય લેશે તથા જરૂર જણાયે પોતાની રીમાર્ક્સ સાથે મંજુરી અંગે ઉપરી અધિકારીશ્રીને અહેવાલ સાદર કરશે.</p> <p>(૩) વિભાગની કામગીરી અંતગાર્ત ઉપરી અધિકારીશ્રીના આદેશનું પાલન કરશે.</p> <p>(૪) વિભાગ અને સંબંધિત કોર્ટલીટીગેશન સંદર્ભે એડવોકેટશ્રીના રૂબરૂ સંપર્કમાં રહી જરૂર જણાયે ઉપરી અધિકારીશ્રીની મંજુરી મેળવી એઝીડેવીટ કરશે.</p> <p>(૫) વિભાગ ધ્વારા કમિટીઓ તથા જનરલ બોર્ડના પ્રશ્નોના જવાબ, સરકારશ્રી તરફથી આવતા પત્રોના જવાબો, માહિતી અધિકાર અધિનિયમ અંતગાર્તની અરજીઓ તથા ખાનગી અરજીઓનો નિકાલ નિયત સમય મર્યાદામાં થાય તે અંગેનું નિરીક્ષણ કરી જરૂરી સુચન કરશે.</p> <p>(૬) વિભાગને લગતી બેઠકો / કમિટીઓમાં હાજર રહી આનુસાંગિક કાર્યવાહી વિભાગ મારફતે કરશે.</p> <p>(૭) વિભાગ તરફથી કરાર થી કામગીરી સૌંપવામાં આવેલ ખાનગી એજન્સીઓની કામગીરીનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુચન કરશે.</p> <p>(૮) હોદ્દાની રૂએ કામગીરી સંબંધિત થયેલા પરિપત્રો અનુસાર ફરજ બજાવવાની રહેશે.</p> <p>(૯) બાંધકામની વિકાસ પરવાનગી તથા તેને સંલગ્ન કામગીરી ધી ગુજરાત ટાઉન પ્લાનીગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ થાય તે અંગે તકેદારી રાખશે તથા વિભાગના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપશે. મધ્યસ્થ શહેર વિકાસ ખાતાના કાર્યક્ષેત્ર હેઠળના હાઈરાઇઝ અને કોમર્શીયલ બિલ્ડીંગોના બાંધકામો ઉપર દેખરેખની કામગીરી અંગે નાયબ શહેર વિકાસ અધિકારીને જરૂરી સુચનાઓ / માર્ગદર્શન આપશે.</p> <p>(૧૦) શહેર વિકાસ ખાતાને લગતી કામગીરીને સંલગ્ન નિતિવિષયક નિર્ણયો કરાવવા સુચનાઓ પરિપત્રીત કરવા જેવી કામગીરી સંબંધે જરૂર જણાયે ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવીને નાયબ શહેર વિકાસ અધિકારીને જરૂરી સુચનાઓ આપીને અમલ કરાવવાની કાર્યવાહી કરશે.</p> <p>(૧૧) શહેર વિકાસ ખાતાને લગતી જોનમાંથી થતી કામગીરીઓનું સંકલન કરવા અંગે નાયબ શહેર વિકાસ અધિકારીને જરૂરી સુચનાઓ / માર્ગદર્શન આપશે.</p> <p>(૧૨) મધ્યસ્થ શહેર વિકાસ ખાતાના કાર્યક્ષેત્ર હેઠળની હાઈરાઇઝ, કોમર્શીયલ, લે-આઉટ પ્રકારની પરવાનગીની અરજીઓ સંબંધે તથા જોન માંથી અભિપ્રાય માટે આવતી વિકાસ પરવાનગીની અરજીઓ અંગે પોતાની રીમાર્ક્સ સાથે ઉપરી અધિકારીને અહેવાલ સાદર કરશે.</p>

૨	નાયબ શહેર વિકાસ અધિકારી (ખાલી જગ્યા)	૦૨	(૧) પોતાના તાબા હેઠળની કામગીરીની દેખરેખ રાખશે. (૨) આસી./જુની. ઈજનેર/ આસી. ટાઉન પ્લાનર ધ્વારા સાદર કરેલ અહેવાલમાં જરૂરી નિર્ણય લેશે તથા જરૂર જણાયે પોતાની રીમાર્ક્સ સાથે મંજૂરી અંગે ઉપરી અધિકારીશ્રીને અહેવાલ સાદર કરશે. (૩) વિભાગની કામગીરી અંતર્ગત ઉપરી અધિકારીશ્રીના આદેશનું પાલન કરશે. (૪) વિભાગ અને સંબંધિત કોર્ટલીટીગેશન સંદર્ભે એડવોકેટશ્રીના રૂબરૂ સંપર્કમાં રહી જરૂર જણાયે ઉપરી અધિકારીશ્રીની મંજૂરી મેળવી એફીડીવીટ કરશે. (૫) વિભાગ ધ્વારા કમિટીઓ તથા જનરલ બોર્ડના પ્રશ્નોના જવાબ, સરકારશ્રી તરફથી આવતા પત્રોના જવાબો, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગતની અરજીઓ તથા ખાનગી અરજીઓનો નિકાલ નિયત સમય મર્યાદામાં થાય તે અંગેનું નિરીક્ષણ કરી તાબા હેઠળના જુની. / આસી. ઈજનેરોને જરૂરી સુચના કરશે. (૬) વિભાગ તરફથી કરાર થી કામગીરી સોંપવામાં આવેલ ખાનગી એજન્સીઓની કામગીરીનું નિરીક્ષણ કરશે અને જરૂરી સુચના કરશે. (૭) હોદ્દાની રૂએ કામગીરી સંબંધિત થયેલા પરિપત્રો અનુસાર ફરજ બજાવવાની રહેશે. (૮) બાંધકામની વિકાસ પરવાનગી તથા તેને સંલગ્ન કામગીરી દી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૮ની જોગવાઈઓ હેઠળ થાય તે અંગે તકેદારી રાખશે તથા વિભાગના સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપશે. મધ્યસ્થ શહેર વિકાસ ખાતાના કાર્યક્ષેત્ર હેઠળના હાઈરાઇઝ અને કોમર્શીયલ બિલ્ડીંગોના બાંધકામો ઉપર દેખરેખની કામગીરી અંગે જુની. / આસી. ઈજનેરોને જરૂરી સુચનાઓ / માર્ગદર્શન આપશે. (૯) શહેર વિકાસ ખાતાને લગતી કામગીરીને સંલગ્ન નિતિવિષયક નિર્ણયો કરાવવા સુચનાઓ પરિપત્રીત કરવા જેવી કામગીરી સંબંધે જરૂર જણાયે ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવીને જરૂરી સુચનાઓ આપીને અમલ કરાવવાની કાર્યવાહી કરશે. (૧૦) શહેર વિકાસ ખાતાને લગતી જોનમાંથી થતી કામગીરીઓનું સંકલન કરવા અંગે તાબા હેઠળના જુની. / આસી. ઈજનેરોને જરૂરી સુચનાઓ / માર્ગદર્શન આપશે. (૧૧) મધ્યસ્થ શહેર વિકાસ ખાતાના કાર્યક્ષેત્ર હેઠળની હાઈરાઇઝ, કોમર્શીયલ, લે-આઉટ પ્રકારની પરવાનગીની અરજીઓ સંબંધે તથા જોન માંથી અભિપ્રાય માટે આવતી વિકાસ પરવાનગીની અરજીઓ અંગે પોતાની રીમાર્ક્સ સાથે ઉપરી અધિકારીને અહેવાલ સાદર કરશે.
૩	આસી.ઈજનેર જુની.ઈજનેર આસી.ટાઉન પ્લાનર	૧૦ ૦૬ ૦૨	(૧) વિભાગમાં ૨જુ થતી હાઈરાઇઝ, કોમર્શીયલ, લે-આઉટ, ભાગલા, એક્ટ્રીકરણની વિકાસ પરવાનગીની અરજીઓ સંબંધે જરૂરી સ્થળ તપાસ કરીને વિગતવાર ચકાસણીનો રીપોર્ટ તૈયાર કરી ઉપરી અધિકારી સમક્ષ રજૂ કરશે. (૨) આંકિટેક્ટ / એન્જીનીયર / સ્ટ્રક્ચરલ ડિઝાઇન / ડેવલપરના નવા ૨જીસ્ટ્રેટેશન તથા રીન્યુઅલ સંબંધેની અરજીઓની ચકાસણી કરીને ઉપરી અધિકારી સમક્ષ રીપોર્ટ રજૂ કરશે.

			<p>(3) વિભાગ ધ્વારા મંજુર કરવામાં આવતા હાઈરાઇઝ તથા કોમર્શીયલ પ્રકારના ચાલતા બાંધકામોની ચકાસણી કરશે અને બી.યુ.સી.ની અરજીઓ સંબંધે સ્થળ ચકાસણી કરીને વિગતવાર રીપોર્ટ ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(4) વિભાગ ધ્વારા મંજુર કરવામાં આવતા હાઈરાઇઝ તથા કોમર્શીયલ પ્રકારના ચાલતા બાંધકામો મંજુર પ્લાન મુજબ થાય છે કેમ તેની ચકાસણી કરીને મંજુર પ્લાન વિરુદ્ધના બાંધકામો સંબંધે કાર્યવાહી કરવા ઉપરી અધિકારી સમક્ષ રીપોર્ટ કરશે.</p> <p>(5) વિભાગ ધ્વારા અપાયેલ પરવાનગી સંબંધે ધી ગુજરાત ટાઉન પ્લાનીગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ ગેરરીતી થયેલ હોવાના પુરાવાઓ ધ્યાને આવતા આથી પરવાનગી રદ કરવા સંબંધે જરૂરી કાર્યવાહીનો રીપોર્ટ ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(6) વિભાગમાં આવતી ફરીયાદ અરજીઓ સંબંધે જરૂર જણાયે સ્થળ તપાસ કરીને જરૂરી કાર્યવાહી અંગેનો રીપોર્ટ ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(7) ખાનગી મિલકતો ઉપર હોર્ડિંગની પરવાનગી મેળવવા સંબંધેની આવતી અરજીઓ સંબંધે જરૂરી ચકાસણીઓ કરીને ઉપરી અધિકારી સમક્ષ રીપોર્ટ રજુ કરશે.</p> <p>(8) વિભાગમાં રજુ થતી આર.ટી.આઈ. અરજીઓ સંબંધે જરૂરી માહિતી આપવા / કાર્યવાહી કરવા જરૂરી રીપોર્ટ / વિગતો / માહિતી તૈયાર કરીને ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(9) વિભાગને મળતી સરકારી / અર્ધસરકારી / ખાનગી / આંતર ખાતાકીય પત્રો / અરજીઓ સંબંધે જરૂરી વિગતો તૈયાર કરીને રીપોર્ટ / જવાબ તૈયાર કરીને ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(10) ઉપરી અધિકારીની સુચના / માર્ગદર્શન મુજબ વિભાગને લગતી નિતી વિષયક નિર્ણયો / પરિપત્રો / સુચનાઓ સંબંધેનો વિગતવાર રીપોર્ટ ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p> <p>(11) વિભાગને લગતા કોર્ટ કેસ સંબંધે વકીલની નિમણુંક કરવા સંબંધે વકીલશી સાથે પરામર્શમાં રહીને કેસ સંબંધિત વિગતો પૂરી પાડવા જરૂરી રીપોર્ટ ઉપરી અધિકારી સમક્ષ રજુ કરશે.</p>
૫	સેક્શન ઓફિસર	૦૧	પર્સનલ એડવાન્સ/ મંજુરી અંગેની સંબંધિત કામગીરી તેમજ ખાતાના બનેલ તમામ પ્રકારના બીલો ચેક કરવા, વહીવટી અહેવાલ, બજેટની માહિતીનું સંકલન કરવુ, સર્વિસબુક ચેક કરવી, સી.એલ કાર્ડ મેન્યુન્ટેઇન કરવા, હાજરી પત્રક ચેક કરવુ. જે તે કલેરીકલ સ્ટાફની ગેરહાજરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી તેવા કામનું સંકલન કરવુ, તેમજ શહેર વિકાસ અધિકારીશી તરફથી વખતો વખત સૌંપવામાં આવે તે કામગીરી કરવી.
૬	પ્રથમ શ્રેણી કલાર્ક	૦૨	<ul style="list-style-type: none"> <li>• આર.ટી.આઈ.ની તમામ કામગીરી</li> <li>• તમામ પ્રકારના બીલ બનાવવા તથા બીલ રજીસ્ટર મેન્યુન્ટેઇન કરવાની કામગીરી</li> <li>• પર્સનલ એડવાન્સમાંથી ખર્ચના બીલ બનાવવા</li> <li>• તમામ કોમ્પ્યુટર, પ્રિન્ટર વિગેરેના નિભાવ તથા જાળવણીની કામગીરી આઈ.એસ.ડી.</li> </ul>

			<p>વિભાગના સંકલનમાં રહીને કરવી.</p> <ul style="list-style-type: none"> <li>• એસ્ટા. કલાર્ક કરેલ કામગીરીની ચકાસણી કરવી.</li> </ul> <p>માલસામાન / સ્ટેશનરીના સ્ટોકની દેખરેખ રાખી જરૂરીયાત મુજબ સેન્ટ્રલ સ્ટોર માંથી માલ-સામાન મંગાવવો.</p>
૭	બીજી શ્રેણી કલાર્ક	૦૨	<ul style="list-style-type: none"> <li>• એસ્ટાબ્લીશમેન્ટને લગતી તમામ કામગીરી</li> <li>• ટી.એ. ડી.એ. બીલ બનાવવા</li> <li>• સ્ટોક રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવવું, પ્રેસ, રેકર્ડની કામગીરી</li> </ul>
૮	ત્રીજી શ્રેણી કલાર્ક	૦૮	<ul style="list-style-type: none"> <li>• દીર્ઘેચ ઈનવર્ડ / આઉટવર્ડની કામગીરી</li> <li>• કેશ વિભાગની કામગીરી તથા સીક્યોરિટી ડિપોઝિટ રજીસ્ટરો નિભાવવા તથા સીક્યોરિટી ડિપોઝિટ અંગેના અભિપ્રાય આપવા.</li> <li>• ડિપોઝિટની રકમ પરત ચુકવવા સંબંધિત બીલ વિગેરેની કામગીરી આવકના હિસાબો મેળવી હિસાબી ખાતા સાથે મેળવવા</li> <li>• સેન્ટ્રલ સ્ટોર માંથી માલ-સામાન લાવવો.</li> <li>• લાયસન્સની તમામ પ્રકારની કામગીરી</li> <li>• કેશીયરની ગેરહાજરીમાં કેશ વિભાગમાં કામગીરી કરવી.</li> <li>• સીક્યોરિટી ડિપોઝિટ ડેટા એન્ટ્રીની કામગીરી.</li> <li>• આર.ટી.આઈ.ની ડેટા એન્ટ્રી</li> <li>• ટાઈપીગની કામગીરી</li> </ul>
૯	પટાવણા	૧૭	ખાતાની ટપાલ વહેંચવાની, નોટીસ બજાવવાની,આસી.ઇજનેર/જુની.ઇજનેર / આસી. ટાઉન પ્લાનર સાથે સાઈટ પર જવાની તેમજ સાફ સફાઈ તથા ઉપરી અવિકારીના હુકમ અનુસાર કરવાની કામગીરી.

મુદ્રા નં.૦૩: દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ:-

(હાઈરાઇઝ, કોમર્શિયલ અને લેઆઉટ પ્રકારની વિકાસ ઓફ લાઈન પરવાનગીની કેન્દ્રસ્થ કામગીરી)

રજીસ્ટર્ડ આર્કિટેક્ટ/એન્જીનીયર મારફત નિયત ચકાસણી ફી ભરપાઈ

કરીને બાંધકામની વિકાસ પરવાનગી

આસી.ઈજેનર/ જુનીયર ઈજનેર ધ્વારા વિસ્તૃત ચકાસણી

નાયબ શહેર વિકાસ અધિકારી, શહેર વિકાસ અધિકારી તથા  
ડેપ્યુટી કમિશનર મારફત વિસ્તૃત ચકાસણી રીપોર્ટ

મ્યુનિ. કમિશનરશ્રી ધ્વારા અંતિમ નિર્ણય

સૈધ્યાંતિક મંજુરીનો પત્ર

બિનખેતીનો હુકમ તથા પર્યાવરણ એન.ઓ.સી. (લાગુ પડતુ હોય તો)  
રજુ થયા બાદ તથા જરૂરી ફી/ડીપોર્ઝીટ ભરપાઈ થયા બાદ રજાચિઠી

આપવી

# વહીવટી માળખું

xxxxxxxxxxxxxx

મ્યુનિ. કમિશનર



કેચ્યુટી કમિશનર



શહેર વિકાસ અધિકારી



નાયબ શહેર વિકાસ અધિકારી



આસી.ઈજનેર/જુની.ઈજનેર/આસી.ટાઉન પ્લાનર

સેક્શન ઓફિસર



પ્રથમ શ્રેણી કલાર્ક



દ્વીજી શ્રેણી કલાર્ક



ત્રીજી શ્રેણી કલાર્ક



પટાવાળા

**મુદ્રા નં.૪:- પોતાના કાર્ય બજાવવા માટે નક્કી કરેલ ધોરણો:**

**The norms set by it for the discharge of its functions:-**

શહેર વિકાસ વિભાગમાં રજુ થતી વિકાસ પરવાનગીની ફાઈલો

- (૧) સોફ્ટ કોપી સ્વરૂપે અત્રેથી તૈયાર કરેલ ઓટો ડિપીએ ફોર્મેટમાં તથા
- (૨) હાર્ડ કોપી સ્વરૂપે રજુ થયા બાદ, તેમાં દિન-૧૫ માં સાઈટ વીજીટ કરી દિન-૮૦ ની સમય મર્યાદામાં વિકાસ પરવાનગી અંગે નિર્ણય લેવામાં આવે છે. વસવાટની અરજી રજુ થયા બાદ સ્થળ ચકાસણી કર્યા બાદ દિન-૨૧ ની સમય મર્યાદામાં વસવાટની પરવાનગી અંગે નિર્ણયો લેવામાં આવે છે તેમજ હાઈરાઇઝ તથા કોમર્શીયલ આયોજનમાં ખાતાની સીધી દેખરેખ હેઠળ બાંધકામમાં તબક્કાવાર સાર્ટિફીકેટ આપવામાં આવે છે.

**મુદ્રા નં.૦૫:- કાર્યો બજાવવા માટે અથવા નિયંત્રણ હેઠળના અથવા કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહોનો રેકર્ડ :**

- શહેર વિકાસ વિભાગને સંલગ્ન નોટીફિકેશન, પરીપત્રો, ખાતાની કામગીરી અંગેના કચેરી હુકમો તથા નોંધની તમામ વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવેલ છે.
- રાજ્ય સરકારશી ધ્વારા તા. ૧૨/૧૦/૨૦૧૭ના નોટીફિકેશનથી સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ-૨૦૧૭ અમલ લાવેલ છે. જેની વિગતો ગુજરાત સરકારશીની વેબસાઈટ <https://townplanning.gujarat.gov.in> પર સંયુક્ત રીતે પ્રકાશિત કરવામાં આવેલ છે.

મુદ્રા નં.૦૬:- પોતાની પાસેના અથવા ખાતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું  
પત્રક:

- (૧) વિકાસ પરવાનગીની અરજીનું ૨જીસ્ટર
- (૨) વિકાસ પરવાનગીનું ૨જીસ્ટર
- (૩) વસવાટ પરવાનગીનું ૨જીસ્ટર
- (૪) પ્રોફેશનલ લાયસન્સની પરમીટ રજીસ્ટર
- (૫) ગૃહ અરજી ૨જીસ્ટર
- (૬) આર.ટી.આઈ. ઈનવર્ડ ૨જીસ્ટર
- (૭) સ્ટોક ૨જીસ્ટર
- (૮) ડેડ સ્ટોક ૨જીસ્ટર
- (૯) બીલ ૨જીસ્ટર
- (૧૦) અપીલ આર.ટી.આઈ. ૨જીસ્ટર
- (૧૧) આરટીઆઈ આઉટવર્ડ ૨જીસ્ટર
- (૧૨) આરટીઆઈ અપીલ આઉટવર્ડ ૨જીસ્ટર
- (૧૩) તબક્કાવાર પ્રોગ્રેસ સર્ટી ૨જીસ્ટર
- (૧૪) પ્લોટ વેલીડેશન સર્ટીનું ઈનવર્ડ ૨જીસ્ટર
- (૧૫) પ્લોટ વેલીડેશન સર્ટીનું આઉટવર્ડ ૨જીસ્ટર
- (૧૬) જનરલ ઈનવર્ડ ૨જીસ્ટર
- (૧૭) જનરલ આઉટવર્ડ ૨જીસ્ટર
- (૧૮) પરચુરણ આમદની ૨જીસ્ટર
- (૧૯) ડીપોઝીટ ૨જીસ્ટર
- (૨૦) રેવેન્યુ સ્ટેમ્પ ૨જીસ્ટર

**મુદ્રા નં.૦૭:- નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર  
વિનિયમ માટે અથવા તેમના ધ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની  
વિગતો :**

જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

**મુદ્રા નં.૦૮:- સલાહના હેતુઓ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિત્વોના બનેલા બોર્ડ કાઉન્સીલો,  
સમિતિઓ વિ. :**

આ કમિટીના સચિવ તરીકે ડેપ્યુટી કમિશનર, સુરત મહાનગરપાલિકાની નિમણુંક થયેલ છે.

સંકલિત વિકાસ નિયંત્રણ નિયમો, ૨૦૧૭ ના નિયમ નં.: ૪.૭ Safety requirement of the building height  
above 45. mt. ની જોગવાઈ અનુસાર રચાયેલ કમિટિના સત્યો નીચે મુજબ છે.

અનુ.નં.	સ્ટ્રક્ચરલ સેફ્ટી કમિટી	નિમણુંક
(૧)	મ્યુ.કમિશનર, સુરત મહાનગરપાલિકા	ચેરમેન
(૨)	મુખ્ય કારોબારી અધિકારી, સુડા	સત્ય
(૩)	ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા	સત્ય
(૪)	સ્ટ્રક્ચરલ એક્ષપર્ટ (એસ.વી.એન.આઈ.ટી.)	સત્ય
(૫)	સુપ્રિન્ટેન્ડિંગ એન્જીનીયર, આર. એન્ડ બી.	સત્ય
(૬)	ડેપ્યુટી કમિશનર, સુરત મહાનગરપાલિકા	સત્ય સચિવ

રાજ્ય સરકાર ધ્વારા તા. ૧૨/૧૦/૨૦૧૭ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં લાવેલ સંકલિત વિકાસ નિયંત્રણ નિયમો, ૨૦૧૭ ના નિયમ નં.: ૩.૧૨.૩ Conflict Resolution Appeal committee ની જોગવાઈ અનુસાર રચાયેલ અપીલ કમિટી, સદરહું કમિટિના સત્યો નીચે મુજબ

અનુ.નં.	Conflict Resolution Appeal committee	નિમણુંક
(૧)	સુડાના ચેરમેન	ચેરમેનશ્રી
(૨)	મ્યુ. કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા	સત્ય
(૩)	ચીફ સીટી પ્લાનર	સત્ય
(૪)	એડિશનલ ચીફ ટાઉન પ્લાનર, ટાઉન પ્લાનીંગ એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત	સત્ય
(૫)	ડેપ્યુટી કમિશનર, સુરત મહાનગરપાલિકા / ચીફ એક્જીક્યુટીવ ઓથોરીટી	સત્ય સચિવ

## મુદ્રા નં. ૮ :— અધિકારીઓ/કર્મચારીઓની માહિતી પુસ્તિકા(ડીરેક્ટરી)

ક્રમ. નં	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	રહેઠાણનું પુરેપુરું સરનામુ ટેલીફોન નંબર સહિત	ટેલીફોન નંબર
૧	શ્રી ઉદ્યકુમાર પી.વસાવા	આસી. ઈજનેર	બી-૦૮, દિવ્ય પ્રભા સોસા., સાંઈ આશિષ સોસા., તાળવણી, રાંદેર રોડ, સુરત	૮૮૦૮૮૨૬૨૭૧
૨	શ્રી વિરેશ ડી નાણાવટી	આસી. ઈજનેર	૧૦૩, અમીઝા એપાર્ટમેન્ટ, મકનજી પાર્ક, જ્ય અંબે મંદિર પાસે, મકાઈપુલ, અડાજણ, સુરત.	૮૮૭૯૦૮૭૯૪૪
૩	શ્રી અશોક વી. ટાંક	આસી. ઈજનેર	૧૨૧, વિજયનગર સોસા., અર્યના સુકલની બાજુમાં, પુણા બોમ્બે માર્કેટ રોડ, સુરત	૮૬૩૮૪૨૨૨૬૬
૪	શ્રીમતી જીવિષા કે. પટેલ	આસી. ઈજનેર	રાજાનંદ શર્મ, નિત્યાનંદશ્વર મંદિર સામે, ધર્મજીવન ચોક પાસે, નાની વેડ, વેડરોડ, સુરત.	૮૫૧૦૬૮૪૬૮૦
૫	શ્રી વિષ્ણુ જરીવાલા	આસી. ઈજનેર	એસ/૪૮, સોમેશ્વર એન્કલેવ સોસાયટી, વી.એન.એસ.પુ. પાસે ઉધના-મગદલા રોડ, વેસુ, સુરત.	૮૭૨૩૪૫૬૪૪૧
૬	શ્રી મયુર એ. જેતાણી	આસી. ઈજનેર	બી/૧૧૦૧, ધ એટલાન્ટિસ, રામકથા રોડ, આંબાતલાવડી, કતારગામ, સુરત.	૮૮૬૬૩૩૮૫૦૩
૭	શ્રી સંકેત એમ. પટેલ	આસી. ઈજનેર	એ-૧૦૮, શાયોના પાર્ક, ખોડીયાર નગરની સામે, અલથાણ, સુરત.	૮૭૧૨૦૫૫૨૬૨
૮	શ્રી મુકુંદ એસ. પોકીયા	આસી. ઈજનેર	એ/૪૦૨, રોયલ હેવન, કિરણ ચોક પાસે, વરાણા રોડ, સુરત.	૮૮૬૬૧૧૫૦૧૩
૯	શ્રી રાહુલ એચ. દરશી	આસી. ઈજનેર	એ-૨૮/૨૮, ધારનાથ એપા., પારસ સોસા., કતારગામ રોડ, સુરત.	૮૭૧૪૭૪૪૮૪૯
૧૦	શ્રી પી. એચ. રાણા	જુની. ઈજનેર	સી-૨૦૨, શિવાલીક ફ્લેટ્સ, ગોવિંદજી પાર્કની પાછળ, ઈંદ્રાનાથ, ઉમરા, સુરત.	૮૮૨૪૧૬૩૪૫૮
૧૧	શ્રી ભરત બી. પટેલ	જુની. ઈજનેર	પર, શીવમ શો-શાઉસ. નવો કોસાડ રોડ, માધવબાગ સુકલની બાજુમાં, અમરોલી, સુરત.	૮૮૨૪૨૨૧૪૪૪
૧૨	શ્રી ધર્મેશ કે. પટેલ	જુની. ઈજનેર (ઓનલોન ટી.પી.)	સી-૫૦૧, આંગન રેસીડેન્સી, અલથાણ, સુરત.	૮૮૭૮૫૧૬૭૧૩
૧૩	શ્રી મયુરકુમાર પી દેસાઈ	સેક્શન એફિસર	સી-૫૦, નિલકંઠ સોસા., સંમુલદેરી રોડ, સુરત.	૮૮૨૪૭૭૬૮૬૧
૧૪	શ્રીમતી હર્ષા એમ. પાઠક	પ્રથમ શ્રેણી કલાર્ક	૭૬, શીવાંજલી રો હાઉસ, લાલ દરવાજા, પટેલવાડી-૩, સુરત.	૯૦૫૫૬૮૬૬૪૯
૧૫	શ્રી હિમાંશુ કે. મહેતા	પ્રથમ શ્રેણી કલાર્ક	૬/૫૦૨, સ્વયંમ રસી.એ૦લપાડ રોડ જહાંગીરપુર સુરત	૯૮૦૪૧૮૧૧૮૨
૧૬	શ્રી હિમાંશુ એન. પટેલ	નીજી શ્રેણી કલાર્ક	૧૫, પહેલો માળ, નવાપરા, કોસાડ રેલ્વે સ્ટેશન પાસે, સુરત.	૯૮૧૩૧૬૬૫૮૦
૧૭	શ્રીમતી ધારા એમ. પટેલ	નીજી શ્રેણી કલાર્ક	૧૦૨૨, તળાવ મહોલે, મુ.પો.ભાઈ, હજીરા રોડ, સુરત.	૯૬૬૨૦૧૬૨૨૪
૧૮	શ્રી શૈલેષ ડી. પટેલ	નીજી શ્રેણી કલાર્ક	૩૦૩, સત્યમ એપાર્ટમેન્ટ, આર.ડી.પાર્ક સોસા., ભટાર, સુરત.	૯૪૨૯૪૮૬૭૫૬
૧૯	શ્રીમતી નિકિતા એમ. પટેલ	નીજી શ્રેણી કલાર્ક	૧/૭૮૭, બેજનજી સ્ટ્રીટ, ખારવાડા, નાનપુરા, સુરત.	૯૬૩૮૮૭૫૩૮૮
૨૦	શ્રીમતી સેજલ કે દેસાઈ	તા.નીજી શ્રેણી કલાર્ક	૮૮, આમંકુંજ સોસાયટી, નર્મદ લાઈબ્રેરીની સામે, ઘોડાંડોડ રોડ, સુરત.	૭૯૯૦૮૪૧૭૨૦
૨૧	શ્રી.રુત્વિક એમ.ભગત	તા.નીજી શ્રેણી કલાર્ક	૨/૨૦૪૬, ૪૭, ગજજર મહોલ્લો, રદરપુરા, સુરત.	૬૩૫૫૮૪૪૬૦૪
૨૨	શ્રી.ગૌરવ સી પટેલ	તા.નીજી શ્રેણી કલાર્ક	૧/૨૮૮, સચીન ગામ, પટેલ ફણીયું,સચીન.	૯૫૩૭૬૭૬૩૪૫
૨૩	શ્રી.નિલેશકુમાર એમ પટેલ	તા.નીજી શ્રેણી કલાર્ક	૭૦૨, મારવેલા રેસી., અલથાણ ભીમરાડ કેનાલ રોડ, ભીમરાડ, સુરત.	૭૫૭૪૮૦૪૧૦૭
૨૪	શ્રી કનુભાઈએન.સોલંકી	પટાવાળા	૨૬૦, મંગલમુર્તિ સોસાયટી, મહાદેવનગર સોસા.ની બાજુમાં, તરસાડી, (કોસાંબા) તા, માંગરોલ, જી.સુરત.	૮૮૦૮૨૪૦૭૨૫
૨૫	શ્રી હિપકુમાર કે.બંડારી	પટાવાળા	બંડારીવાડ,મુ.પો. ડીડોલી, વાયા ઉધના, જી.સુરત.	૮૮૦૯૧૪૦૮૬૩
૨૬	શ્રી હીરાલાલ લખુભાઈ પટેલ	પટાવાળા	મુ.નવા મગદલા, પો. ડુમસ, ખેડવાડ સ્ટ્રીટ, સુરત-૭૮૪૨૭૦	૯૭૨૭૬૮૦૮૪૬
૨૭	શ્રી વિજયકુમાર ડી.કંથારીયા	પટાવાળા	પટેલ વાડી-૩, રામપુરા, રામબાગ, કબિર મંદિર પાસે, લાલ દરવાજા, સુરત-૭૮૫૦૦૩	૯૮૭૯૮૮૪૭૦૦૨
૨૮	શ્રી મનીષ પી.નલાવડે	પટાવાળા	૧૦/૧૨૫૮, અંબાજીરોડ, હવાડીયા ચકલા, ગોધામણીયાની પોળ, સુરત.૭૮૫૦૦૩	૮૮૨૦૩૪૨૪૫૨

ક્રમ. નં	અધિકારી/કર્મચારીનું નામ	હોદ્દો	રહેઠાણનું પુરેપુરું સરનામું ટેલીફોન નંબર સહિત	ટેલીફોન નંબર
૨૯	શ્રી હર્ષદકુમાર સી.પટેલ	પટાવાળા	૧૭૪, નવાપરા, ભવાની મહોલ્લો, મુ. મલગામા, પો. બેંસાંશ, તા.ચોર્યાસી, ડી.સુરત ૩૮૫૦૦૫	૯૮૭૮૨૫૬૭૪૮
૩૦	શ્રી અદ્યેશભાઈ એ.પટેલ	પટાવાળા (ઓનલોન ટી.પી.)	૧૨૬, તળાવ ફળીયું, મુ.પો. હજીરા, તા.ચોયાસી, ડી.સુરત	૯૮૬૮૪૪૦૨૨૫
૩૧	શ્રી રાહુલ એમ. પારદી	પટાવાળા	૭/૧૭૪૫, રોહીદાસ હા. સોસા., સર્યદપુરા શાક માર્કેટની સામે, સુરત.	૯૭૧૪૨૪૬૬૪૪૨
૩૨	શ્રી ધવલ એસ.સોલંકી	પટાવાળા	સી-૫૦૩, રાજહંસ રેસી., સુભાષ ગાડીન પાસે, ડોક્ટર પાર્ક રોડ, જહાંગીરપુરા, સુરત.	૯૬૩૮૨૬૬૬૪૪૩
૩૩	શ્રી કરણ પી. સુરતી	પટાવાળા	૧૦૧, દર્શન, દીપ-દર્શન કો.ઓ.હા. સોસાયટી, મહાલક્ષ્મી મંદિર પાસે, આનંદ-મહલ રોડ, અડાજણા, સુરત.	૭૨૨૮૦૯૭૫૦૬
૩૪	શ્રી આયુષ જી. કથાંરીયા	પટાવાળા	૧૭, હરિજનવાસ, દુમસ ગામ, સુરત.	૭૩૮૩૦૦૮૧૧૫
૩૫	શ્રી યશ દિનેશ પરમાર	તાર્લી.પટાવાળા	૨/૨૭૩૭, નડીયાવાદ, ક્ષેત્રપાલ મંદિર રોડ, સગરામપુરા, સુરત.	૭૦૪૮૫૫૫૨૭૬
૩૬	શ્રી મીત પી. ચૌહાણ	તાર્લી. પટાવાળા	૮૬, ગણેશકૃપા સોસાયટી, પાલનપુર કેનાલ રોડ, પાલ, સુરત.	૯૩૧૩૦૫૭૫૨૫

મુદ્રા નં. ૧૦:- દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા.  
માહે એપ્રિલ-૨૦૨૨ પેઇડ ઈન મે-૨૦૨૩

ખાતાનું નામ :— શહેર વિકાસ (મધ્યસ્થ)  
જગ્યાનો પ્રકાર :— કાયમી

પે.સેન્ટર નં. H011  
બજેટ સેન્ટર કોડ એચ.0૪૧

સને ૨૦૨૨-૨૩

અ.નં.	જગ્યાનું નામ (હોદ્દો)	કુલ સંખ્યા	પગાર ધોરણા	ગ્રેડ પે
૧	શહેર વિકાસ અધિકારી	૦૧	૧૫૬૦૦-૩૬૧૦૦	૬૬૦૦
૨	નાયબ શહેર વિકાસ અધિકારી	૦૨	૧૫૬૦૦-૩૬૧૦૦	૫૪૦૦
૩	આસી. ટાઉન પ્લાનર	૦૨	૧૫૬૦૦-૩૬૧૦૦	૫૪૦૦
૪	આસી.ઈજેનર(સીવીલ)	૧૦	૧૫૬૦૦-૩૬૧૦૦	૫૪૦૦
૫	જુનીયર ઈજનેર(સીવીલ)	૦૬	૧૫૬૦૦-૩૬૧૦૦	૫૪૦૦
૬	સેક્શન ઓફિસર	૦૧	૬૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૭	પ્રથમ શ્રેષ્ઠી કલાર્ક	૦૨	૬૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૮	બીજી શ્રેષ્ઠી કલાર્ક	૦૨	૬૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૯	તૃજી શ્રેષ્ઠી કલાર્ક	૦૮	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૦	પટાવાળા	૧૭	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦

ક્રમ. નં	અધિકારી/કર્મચારીનું નામ	કર્મચારી નંબર	હોદ્દો	માસિક મહેનતાણું તથા વળતર/ભથ્થા વિગેરે
૧	શ્રી ઉદ્યકુમાર પી. વસાવા	૩૬૨૭૮	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૨	શ્રી વિરેશ ડી. નાણાવટી	૩૬૪૮૬	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૩	શ્રી અશોક વી. ટાંક	૩૭૦૪૨	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૪	શ્રી જીગીધા કે. પટેલ	૩૭૦૬૨	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૫	શ્રી વિષ્ણુ એચ. જરીવાલા	૩૭૦૬૭	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૬	શ્રી મયુર એ. જેતાણી	૩૭૧૧૨	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૭	શ્રી સંકેત એમ. પટેલ	૩૭૪૮૪	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૮	શ્રી મુકુંદ એસ. પોકીયા	૩૭૫૩૭	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૯	શ્રી રાહુલ એચ. દરજી	૩૭૬૧૭	આસી. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૧૦	શ્રી પી. એચ. રાણા	૩૪૫૬૦	જુની. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૧૧	શ્રી ભરત બી. પટેલ	૪૦૩૦૨	જુની. ઈજનેર	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૧૨	શ્રી ધર્મશ કે. પટેલ	૪૦૮૨૮	જુની. ઈજનેર (ઓનલોન ટી.પી.)	૫૬૧૦૦-૧૭૭૫૦૦
૧૩	શ્રી મયુર પી. દેસાઈ	૧૧૬૨૮	સેક્શન ઓફિસર	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૪	શ્રી હિમાંશુ કે. મહેતા	૧૮૨૨૫	હેડ કલાર્ક	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૫	શ્રીમતી હર્ષા એમ. પાઠક	૧૩૬૨૧	હેડ કલાર્ક	૪૪૬૦૦-૧૪૨૪૦૦
૧૬	શ્રી હિમાંશુ અન. પટેલ	૪૭૮૩૬	ત્રીજી શ્રેણી કલાર્ક	૧૬૬૦૦-૬૩૨૦૦
૧૭	શ્રીમતી ધારા એમ. પટેલ	૪૭૮૩૭	ત્રીજી શ્રેણી કલાર્ક	૧૬૬૦૦-૬૩૨૦૦
૧૮	શ્રી શૈલેષ ડી. પટેલ	૪૭૮૩૮	ત્રીજી શ્રેણી કલાર્ક	૧૬૬૦૦-૬૩૨૦૦
૧૯	શ્રીમતી નિકિતા એમ. પટેલ	૪૭૮૩૯	ત્રીજી શ્રેણી કલાર્ક	૧૬૬૦૦-૬૩૨૦૦
૨૦	શ્રીમતી સેજલ કે. દેસાઈ	૭૩૮૬૩	તાર્લી. ત્રીજી શ્રેણી કલાર્ક	ફિક્ષ પગાર
૨૧	શ્રી રૂત્વિક એમ. ભગત	૭૫૪૮૫	તાર્લી. ત્રીજી શ્રેણી કલાર્ક	ફિક્ષ પગાર
૨૨	શ્રી ગૌરવ સી. પટેલ	૭૫૬૨૪	તાર્લી. ત્રીજી શ્રેણી કલાર્ક	ફિક્ષ પગાર
૨૩	શ્રી નિલેશકુમાર એસ. પટેલ	૭૫૬૨૫	તાર્લી. ત્રીજી શ્રેણી કલાર્ક	ફિક્ષ પગાર
૨૪	શ્રી કનુ એન. સોલંકી	૧૧૦૨૨	પટાવાળા	૨૫૫૦૦-૮૧૮૦૦
૨૫	શ્રી હિપક કે. ભંડારી	૧૩૮૧૫	પટાવાળા	૨૫૫૦૦-૮૧૮૦૦
૨૬	શ્રી હિરાલાલ એલ. પટેલ	૧૪૭૨૧	પટાવાળા	૨૫૫૦૦-૮૧૮૦૦
૨૭	શ્રી વિજય ડી. કંથારીયા	૧૭૬૧૩	પટાવાળા	૨૫૫૦૦-૮૧૮૦૦
૨૮	શ્રી મનીષ પી. નલાવડે	૩૪૭૨૩	પટાવાળા	૨૫૫૦૦-૮૧૮૦૦
૨૯	શ્રી હર્ષદ સી. પટેલ	૩૪૧૦૨	પટાવાળા	૧૬૬૦૦-૬૩૨૦૦
૩૦	શ્રી રાહુલ એમ. પારદ્ધી	૪૬૩૧૧	પટાવાળા	૧૫૭૦૦-૫૦૦૦૦
૩૧	શ્રી ધવલ એસ. સોલંકી	૭૩૮૮૩	તાર્લી. પટાવાળા	ફિક્ષ પગાર
૩૨	શ્રી કરન પી. સુરતી	૭૩૮૮૪	તાર્લી. પટાવાળા	ફિક્ષ પગાર
૩૩	શ્રી આયુષ જી. કંથારીયા	૭૫૦૨૩	તાર્લી. પટાવાળા	ફિક્ષ પગાર
૩૪	શ્રી અલ્પેશ એ. પટેલ	૩૪૮૮૩	પટાવાળા (ઓનલોન ટી.પી.)	૧૬૬૦૦-૬૩૨૦૦
૩૫	શ્રી યશ દિનેશ પરમાર	૭૬૫૨૨	તાર્લી. પટાવાળા	ફિક્ષ પગાર
૩૬	શ્રી મીત પી. ચૌહાણ	૭૬૫૨૭	તાર્લી. પટાવાળા	ફિક્ષ પગાર

મુદ્રા નં. ૧૧:- તમામ યોજનાઓ, સુચિત ખર્ચ ચુકવેલ નાણાં પરના અહેવાલોની વિગતો દર્શાવતું  
અંદાજપત્ર:

શીડયુલઉ.૨ એકનીત રેવન્યુ આવક તથા કેપિટલ આવક

બજેટ સેન્ટર કોડ -૦૪૧

અ.નં	એકાઉન્ટ હેડ	એકા.કોડ	મુળ જોગવાઈ ૨૦૨૨-૨૩	૩૧-૩-૨૩ સુધીની થયેલ આવક
૧	તપાસ ફી (ચકાસણી)	૧૨૪૨	૧૪૦૦	૧૮૪૪.૩૮
૨	માહિતી અધિકાર નિયમ	૧૨૪૬	૧.૪	૧.૦૭
૩	લાયસન્સ ફી	૧૨૫૧	૨૦૦	૨૩૪.૭૬
	પ્રિમીયમ ફી			
	બાલ્કની કવર્ડ ફી			
૪	ફોર્મ વેચાણ	૧૭૫૩	૦	-
૫	અન્ય પરચુરણ આવક	૧૮૦૯	૫૫	૫૦.૬૫
૬	ચેક રીટર્ન ચાર્જ	૧૨૩૪	૫૫	૫૦.૬૫
૭	ઇન્ટરેસ્ટ ઓન લેટ જનરલ ઇન્કમ	૧૭૧૭	૫૦૦	૭૫૫.૪૮
૮	બેટરમેન્ટ ચાર્જ/અમીનીટી ફી	૭૧૧૧	૧૦૦૦	૮૧૩.૪૩
૯	ઇમ્પોક્ટ ફી (ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ)	૭૧૨૬	૧૦	૦.૦૧
બજેટ સેન્ટર એચ-૦૫૧, અર્બન ટ્રાન્સપોર્ટ (બીઆરટીએસ)				
રેવન્યુ આવક				
૧	એડી. ઇન્ફાસ્ટ્રક્ચર ચાર્જ પેઈડ એફ.એસ.આઈ	૧૨૭૮	૫૦૦૦૦	૫૨૫૭૨.૬૬

**શીડિયુલ.૨ એક્સ્પ્રેસ રેવન્યુ ખર્ચ તથા કેપીટલ ખર્ચ**

**બજેટ સેન્ટર કોડ -૦૪૧**

**રૂ. લાખમાં**

અ.નં	એકાઉન્ટ હેડ	એકા.કોડ	૨૦૨૨-૨૦૨૩ની મંજુર જોગવાઈ	૩૧-૦૩-૨૩ સુધીમાં થયેલ ખર્ચ
૧	વાહન ભાડુ ખર્ચ	2302	6.5	7.94
૨	તાર-ટપાલ ખર્ચ	2331	0.30	0.09
૩	છપામણી	2351	0.50	0.0
૪	કોમ્પ્યુટર સ્ટેશનરી	2352	0.40	0.05
૫	અન્ય સ્ટેશનરી	2353	6.50	4.56
૬	ફ્લોપી ડિસ્ક અને ટેપ	2354	0.50	0.30
૭	સ્થાનિક મુસાફરી ખર્ચ	2371	0.05	-
૮	કાયદા ફી	2442	2.50	1.25
૯	સલાહકાર ફી	2443	1.00	1.00
૧૦	જાહેરાત ખર્ચ	2482	0.10	0.08
૧૧	સભા/ સેમિનાર/ સંવાદ ખર્ચ	2484	0.25	-
૧૨	કર્મચારી તાલીમ ખર્ચ	2486	0.25	-
૧૩	અન્ય પરચૂરણ ખર્ચ	2499	4.00	0.56
૧૪	મરામત- ઓફિસ સાધનો	3009	0.25	-
૧૫	સેવાને લગતો કોન્ટ્રાક્ટ ખર્ચા	3505	2.00	-

**કેપીટલ ખર્ચ**

૧	સ્થાયી મિલકતોની ખરીદી કોમ્પ્યુટર સાધનો	5751	5.00	3.56
૨	ફર્નિચર	5771	2.50	00
૩	ઇલે. ઇક્વિપમેન્ટ	5752	0.50	0.20

## શીડયુલ ઉ.૨ એકત્રીત રેવન્યુ આવક તથા કેપિટલ આવક

બજેટ સેન્ટર કોડ -૦૪૧

રૂ. લાખમાં

અ.નં	એકાઉન્ટ હેડ	એકા.કોડ	મુણ જોગવગાઈ ૨૦૨૨-૨૩	૩૧-૩-૨૩ સુધીની થયેલ આવક
૧	તપાસ ફી (ચકાસણી)	૧૨૪૨	૧૪૦૦	૧૯૪૪.૩૮
૨	માહિતી અધિકાર નિયમ	૧૨૪૬	૧.૫	૧.૦૭
૩	લાયસન્સ ફી	૧૨૪૧	૨૦૦	૨૩૪.૭૬
	પ્રિમીયમ ફી			
	બાલ્કની કવર્ડ ફી			
૪	ફોર્મ વેચાણ	૧૭૫૩	૦	-
૫	અન્ય પરચુરણ આવક	૧૮૦૯	૫૫	૫૦.૯૫
૬	ચેક રીટર્ન ચાર્જ	૧૨૭૪	૫૫	૫૦.૯૫
૭	ઇન્ટરેસ્ટ ઓન લેટ જનરલ ઇન્કમ	૧૭૧૭	૫૦૦	૭૫૫.૪૮
૧	બેટરમેન્ટ ચાર્જ/એમીનીટી ફી	૭૧૧૧	૧૦૦૦	૮૧૩.૪૩
૨	ઇમ્પેક્ટ ફી (ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ)	૭૧૨૬	૧૦	૦.૦૧
બજેટ સેન્ટર એચ-૦૪૧, અર્બન ટ્રાન્સપોર્ટ (બીઆરટીએસ)				
<b>રેવન્યુ આવક</b>				
૧	એડી. ઇન્ફાસ્ટ્રક્ચર ચાર્જ પેઇડ એફ.એસ.આઈ	૧૨૭૮	૫૦૦૦૦	૫૨૫૭૨.૮૬

**મુદ્રા નં. ૧૨:- ફણવેલ રકમો સહિત સબસીડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગત:**

જાહેર સત્તા મંડળ સાથે સયુંકૃત છે, અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

**મુદ્રા નં. ૧૩:- છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગત:**

અ.નં.	લાયસન્સની વિગત	આપેલ સંખ્યા
(૧)	આર્કિટેક્ટ	૫૪૨
(૨)	એન્જીનીયર	૧૮૫૦
(૩)	સાઈટ સુપર વાઈઝર	૮૭૮
(૪)	ડેવલપર	૩૧૧૮
(૫)	સ્ટ્રક્ચરલ ડીઝાઇનર	૬૮૭
(૬)	સર્વેયર	૨૪૧
(૭)	સ્ટ્રક્ચરલ એક્શપટ	૨૫
(૮)	સાઈટ સુપરવાઈઝર ફો ટોલ બિલ્ડિંગ	૧૦
(૯)	કલાર્ક ઓફ વર્ક	૨૫

**શહેર વિકાસ મધ્યસ્થ ખાતા વર્ષ વાઈઝ ધ્વારા ઈસ્યુ કરવામાં આવેલ  
વિકાસ પરવાનગીની માહિતી દર્શાવતું પત્રક**

અ.નં.:	વર્ષ	આપેલ સંખ્યા
(૧)	૨૦૦૫-૦૬	૫૨
(૨)	૨૦૦૬-૦૭	૨૭૪
(૩)	૨૦૦૭-૦૮	૨૪૨
(૪)	૨૦૦૮-૦૯	૩૫૨
(૫)	૨૦૦૯-૧૦	૩૪૮
(૬)	૨૦૧૦-૧૧	૩૭૦
(૭)	૨૦૧૧-૧૨	૫૩૩
(૮)	૨૦૧૨-૧૩	૫૬૫
(૯)	૨૦૧૩-૧૪	૫૮૫
(૧૦)	૨૦૧૪-૧૫	૩૫૮
(૧૧)	૨૦૧૫-૧૬	૫૩૫
(૧૨)	૨૦૧૬-૧૭	૫૬૩
(૧૩)	૨૦૧૭-૧૮	૬૮૦
(૧૪)	૨૦૧૮-૧૯	૬૫૮
(૧૫)	૨૦૧૯-૨૦	૩૪૬
(૧૬)	૨૦૨૦-૨૧	૨૧૨
(૧૭)	૨૦૨૧-૨૨	૩૨૮
(૧૮)	૨૦૨૨-૨૩	૩૨૨

શહેર વિકાસ મધ્યસ્થ ખાતા ધ્વારા વર્ષ વાઈજ ડી.સી.આર.—૨૦૦૪ તથા સી.જી.ડી.સી.આર—૨૦૧૭  
 મુજબ ઈસ્યુ કરવામાં આવેલ વસવાટની પરવાનગીની (બી.યુ.સી.) માહિતી દર્શાવતું પત્રક

અ.નં.	વર્ષ	આપેલ સંખ્યા
(૧)	૨૦૦૫-૦૬	૧૩૬
(૨)	૨૦૦૬-૦૭	૧૦૪
(૩)	૨૦૦૭-૦૮	૧૧૯
(૪)	૨૦૦૮-૦૯	૧૦૦
(૫)	૨૦૦૯-૧૦	૧૪૯
(૬)	૨૦૧૦-૧૧	૧૪૧
(૭)	૨૦૧૧-૧૨	૧૪૨
(૮)	૨૦૧૨-૧૩	૧૦૭
(૯)	૨૦૧૩-૧૪	૧૦૯
(૧૦)	૨૦૧૪-૧૫	૨૨૫
(૧૧)	૨૦૧૫-૧૬	૨૧૮
(૧૨)	૨૦૧૬-૧૭	૨૭૨
(૧૩)	૨૦૧૭-૧૮	૨૩૧
(૧૪)	૨૦૧૮-૧૯	૧૬૮
(૧૫)	૨૦૧૯-૨૦	૧૭૩
(૧૬)	૨૦૨૦-૨૧	૧૫૨
(૧૭)	૨૦૨૧-૨૨	૨૬૧
(૧૮)	૨૦૨૨-૨૩	૨૬૪

## મુદ્રા નં. ૧૪:- ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીને લગતી વિગતો:

શહેર વિકાસ (મધ્યસ્થ) ખાતામાં ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અથવા તેણે ધરાવેલ માહિતીને લગતી વિગતો

[www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in)

Auto DPA Software.

- Development Permission List
- Building Use Permission List
- Registered Professionals List
  - Architect
  - Engineer
  - Structural Engineer
  - Developer
  - Surveyor
  - Site Supervisor
  - Structural Expert
  - Site Supervisor for Tall Building

### On Line Development Permission System (ODPS/E-Nagar)

Sr. No.	Details	Remarks
1	Whether Online Development Permission System (ODPS) is operational in the city?	Yes
2	If no , by what time online plan approval will be introduced?	-
3	Whether Common Application Form capturing requirements of NOC from all internal/external agencies have been devised and uploaded?	-
4	Whether online integration of Internal/External Agencies for NoC done? Which ones?	No
5	Whether provision of online fee calculator for building plan approval has been done in ODPS?	Yes
6	Whether Risk Based Classification of buildings and time frame for building plan approval inspection and issuance of occupancy cum completion certificate based on this classification done?	No

Sr. No.	Details	Remarks
7	Who is the Nodal Officer and what is his contact details?	Shree S. P. Patel. I/c. Town Development Officer, (Town Development Department) Mob. 9825897490
8	Whether exclusive online submission (without requirement of any hard copies) is operational? By when it will be done?	Yes
9	Whether there is any requirement of personal interaction for building proponent with the officials of ULB/Agency issuing building permits is there?	No
10	Whether online payment system made operational? Since when?	Yes
11	Whether building permits being issued online with digital signature? If not, by when this will be done?	Yes

**મુદ્રા નં. ૧૫:- જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેના વાંચનકક્ષના  
કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની  
વિગતો:**

જાહેર સત્તા મંડળ સાથે સયુંકૃત છે, અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

મુદ્રા નં. ૧૬:- જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદ્રો અને બીજી વિગતો  
સરકારી તંત્રનું નામ :— સુરત મહાનગરપાલિકા,

વિભાગ :— શહેર વિકાસ મધ્યસ્થ

(તા.૦૧-૦૫-૨૦૨૩ ની સ્થિતીએ)

જાહેર માહિતી અધિકારી :—

અ.નં	અધિકારીનું નામ	હોદ્રો	એસ.ટી.ડી. કોડ	કચેરીનો ફોન નંબર	ફેક્સ નંબર
૧	શ્રી વિરેશ.ડી. નાણાવટી	આસી. ઈજનેર	૦૨૬૧	૨૪૨૩૭૫૧ થી ૫૬ મો.૮૮૭૯૮૦ – ૮૭૮૪૪	૦૨૬૧ – ૨૪૫૧૯૮૫

અપીલ અધિકારી :—

અ.નં	અધિકારીનું નામ	હોદ્રો	એસ.ટી.ડી. કોડ	કચેરીનો ફોન નંબર	ફેક્સ નંબર
૧	શ્રી સંજય પી. પટેલ	ઈ.ચા. શહેર વિકાસ અધિકારી	૦૨૬૧	૨૪૨૩૭૫૧ થી ૫૬ મો.૮૮૨૫૮ – ૮૭૪૫૦	૦૨૬૧ – ૨૪૫૧૯૮૫

**મુદ્રા નં. ૧૭:- ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી:**

XVII	Such other information as may be prescribed and thereafter update these published every year	Every 3 months department update all the information published on web site.
------	--	---

## ઓનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧-૫-૨૦૦૮ ના પરીપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪ –  
આરટીઆઈસેલનું બીડાણ)

### પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના શહેર  
વિકાસ(મધ્યસ્થ) ખાતા ધ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતગાર્ત સ્વયં જાહેર કરવાની બાબતનો  
(પ્રોએક્ટીવ ડિસ્કલોઝર) (PAD)તૈયાર કરવામાં આવી છે અને તા.૦૧-૦૫-૨૦૨૩ ની સ્થિતિએ તે અધતન  
કરવામાં આવેલ છે. જેનું અમારા ધ્વારા માહે: મે-૨૦૨૨ દરમ્યાન ઈન્સ્પેક્શન કમ ઓડીટ કરવામાં આવ્યું છે અને  
જે બાબતે ક્ષતિ જણાય હતી અગાર તો અપૂરતી વિગતો જણાય હતી. તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

તા...../...../૨૦૨૩ ની સ્થિતિએ હવે કોઈ (પ્રોએક્ટીવ ડિસ્કલોઝર)(PAD)નું ઈન્સ્પેક્શન કમ ઓડીટ  
બાકી રહેલ નથી.

તા. /૦૮/૨૦૨૩  
સુરત.

ઈ.ચા. શહેર વિકાસ અધિકારી  
શહેર વિકાસ(મધ્યસ્થ)ખાતું  
સુરત મહાનગરપાલિકા

સ.રવાના એક્ઝિક્યુટીવ આસી.શ્રી(આઈ.એસ.ડી.વિભાગ) પ્રતિ,

ડ.કમિશનર અને નોડલ ઓફિસરશ્રી રાઈટ ટુ ઈન્ફર્મેશન સેલના પત્ર નં.આરટીઆઈસેલ/૧૨,  
તા.૨૭/૦૪/૨૦૨૭ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ અન્વયે શહેર વિકાસ (મધ્યસ્થ)  
ખાતાનું પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD) ઈન્સ્પેક્શન કમ ઓડીટ કરી તેનું પ્રમાણપત્ર તથા સ્વયં જાહેર કરી તેની  
માહિતીની સોફ્ટ કોપી આ સાથે સામેલ કરેલ છે, જે આપશ્રીને વિદિત થાય.

બિડાશ: પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD)ની સોફ્ટ કોપી

નં.ટીડીઓ./  
તા. /૦૮/૨૦૨૭

જાહેર માહિતી અધિકારી અને  
આસી. ઈજનેર  
શહેર વિકાસ (મધ્યસ્થ) ખાતું  
સુરત મહાનગરપાલિકા

નકલ સા.રવાના: નોડલ ઓફિસરશ્રી(આર.ટી.આઈ.સેલ) પ્રતિ.... એનેક્ષર-એના પ્રમાણપત્ર સહિત જાણ સારુ.

સ.રવાના એક્ઝિક્યુટીવ આસી.શ્રી(આઈ.એસ.ડી.વિભાગ) પ્રતિ,

ડ.કમિશનર અને નોડલ ઓફિસરશ્રી રાઈટ ટુ ઈન્ફર્મેશન સેલના પત્ર નં.આરટીઆઈસેલ/૧૨,  
તા.૨૭/૦૪/૨૦૨૭ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની કલમ-૪ અન્વયે શહેર વિકાસ (મધ્યસ્થ)  
ખાતાનું પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD) ઈન્સ્પેક્શન કમ ઓડીટ કરી તેનું પ્રમાણપત્ર તથા સ્વયં જાહેર કરી તેની  
માહિતીની સોફ્ટ કોપી આ સાથે સામેલ કરેલ છે, જે આપશ્રીને વિદિત થાય.

બિડાશ: પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD)ની સોફ્ટ કોપી

નં.ટીડીઓ./  
તા. /૦૮/૨૦૨૭

જાહેર માહિતી અધિકારી અને  
આસી. ઈજનેર  
શહેર વિકાસ (મધ્યસ્થ) ખાતું  
સુરત મહાનગરપાલિકા

નકલ સા.રવાના: નોડલ ઓફિસરશ્રી(આર.ટી.આઈ.સેલ) પ્રતિ.... એનેક્ષર-એના પ્રમાણપત્ર સહિત જાણ સારુ.